



JY-16070401031900 Seat No. _____

B. R. S. (Sem. III) (CBCS) Examination

October - 2019

Agronomy

(Int. to Pl. Breeding & Gene - I)

(Core - 7) (New Course)

Time : 2 Hours]

[Total Marks : 50

1 पाक संवर्धन एटले शु ? समજावी, पाक संवर्धनना हेतुओ तथा मહत्व 10
विस्तारथी समજावो.

અથવા

1 નૂતન કલમ એટલે શુ ? સમજાવી, આંબામાં નૂતન કલમ તૈયાર કરવાની
રીત આકૃતિ સાથે સમજાવો.

2 નીચેનામાંથી કોઈ પણ ઓક પ્રશ્નનો વિગતે ઉત્તર લખો : 10

(1) બીજેતર સંવર્ધન એટલે શુ ? સમજાવી, બીજેતર સંવર્ધનના
ફાયદા-ગેરફાયદા સમજાવો.

(2) પાક સંવર્ધનનો અન્ય વિજ્ઞાનની વિદ્યાશાખા સાથેનો સંબંધ સમજાવો.

3 નીચેનામાંથી કોઈ પણ ત્રણ ટૂકનોંધ લખો : 14

- (1) ભાજનોતરાવસ્થા
- (2) કોષકેન્દ્ર અને તેના કાર્યો
- (3) કણાભસૂત્ર
- (4) પુષ્પના ભાગો
- (5) આંખ કલમ

4 નીચેનામાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના માણ્યા મુજબ જવાબ આપો : 14

- (1) નીલકણો વિશે ટૂકમાં સમજણ આપો.
- (2) ઝાયગોટીન અવસ્થા આકૃતિ સાથે સમજાવો.
- (3) સંપૂર્ણપુષ્પ એટલે શુ ? ઉદાહરણ સાથે સમજાવો.
- (4) દ્વિગૃહી વનસ્પતિ એટલે શુ ? ઉદાહરણ સાથે સમજાવો.
- (5) રીબોઝોમ અને તેનું કાર્ય સમજાવો.
- (6) વનસ્પતિની કોષદિવાલ કયાં પદાર્થોની બનેલી છે તે ટૂકમાં સમજાવો.
- (7) રંગસૂત્રના પ્રકારો સમજાવો.